

## REGISTER B. NO. 156

श्री

५.२० रु. रु. १६६०  
अंक २ ल. ७३ै जैनधर्म प्रकाशि.

शिखरिणी विचार,

धनं दर्शं विचं जिनवचनमध्यस्थमस्तिं ।  
क्रियाकांडं चंडं रचितमननौ सुतप्रसङ्गत ॥  
तपस्तिं गते चरणप्रपि चीर्णि चिरतरं ।  
नचेचिते भावतुपयप्रवत्सर्वमफलम् ॥ २ ॥

प्रगट कर्ता,

श्री जैनधर्म असारक सभा,

लालनगर

अलुकप्रणिका

१	शुद्धकर्म उपहारा,	२५
२	आत्मोपहारा,	२७
३	धनपाल,	२७
४	जिमोंदेवी,	३४
५	“साचान्य छित रिक्षा,”	३२
६	थस्या प्रय,	४७

## रमभट्टावाह

ज्ञानेश्वर वार्षिक असेस” आ  
नशुद्धाध रत्नाचल भारतीयाचे छाप्पुन  
प्रीत संस्कृत १८३० दाढे १८२८ सने १८०४  
पापिक मूर्त्य (११) पैस्टेज व्यार आना,



શાપાનિયું રખડતું મુશ્કીને આશાતના કરવી નહીં  
તૈયાર થઈ છે.

### નવા વર્ષની ભેટ.

“રલશોખર રાજ ને રલબતી રાણીની ઇથા.” એ યું  
તૈયાર થઈ એ ધાર્યવા માંદી છે. તાકીદે આદકો તરફ રચાતે કરન  
વામાં આવશે પરંતુ જેમણે ગયા વર્ષનું લયાજમ ગોકલેલું છે  
તેમનેજ તેનો લાલ મળી રહે છે. યુક્ત હર વર્ષની સેટ કરતા  
પ્રમાણુમાં મોટી થઈ છે તે નાથે એટલી બચ્ચી રસિક ને અસર  
કારક છે કે લાલી ઐનારને પસ્તાવી થયા શિવાય રહેજ નહીં  
હજુ પણ એક વર્ષત તક આપવા વાર્ષિક છે તે એવી રીતે કે ને  
નવા વર્ષના લયાજમ સાથે પાછલા વર્ષનું સેહેલું લયાજમ મેં  
કલારી તેને સેટ મોકલવામાં આવશે. જેણા વેદ્યપેભસથી અગા  
બશે તેને તેમ પણ મોકલવામાં આવશે તેમાં ભાગ એક આનોજ  
વધારે લાગશે. વચ્ચા મંગાવતાર માટે કિભત વાર આના રા  
ખવામાં આપી છે. યુક્તના વખતું વાંચનાર પ્રાતેજ હર તેમ  
હોનાથી અમારે કરવાની જરૂર નથી. તાત્રી.

### શ્રી બનારસ જૈન પાઠશાળાની ચાલતા ચર્ચિતર માસકી કારવાઈ.

સંવેગી સાધુ ધર્મવીજેજી મહારાજાની ઉપદેશસે નીચે મુજબ  
કાર્ય હુંવા હૈ;—

૧ દર્શ આદર્ભીયને સુનું જીવિર્હિતાની લાગ કરા.

૨ એક આદર્ભની પાંસ ભક્ષણની લાગ કરા.

૩ એક વેદ્યધર્મી જો હોમ હવનમે જન્મોકા વહીદાન દેતાથા  
ઉસને અથ એકદમ જીવિર્હિતા છોડદી. ॥

૪ જીન જણ જીવિદ્યા વિષે ભારત દેનેકું તિયાર હુંવે હૈ.

૫ એક પટેલ કાશીમે દેહ લ્યાગ કરનેકું આયેદે. જો પત્તીવોષ  
પાકે દોકા લેનેકું તિયાર હુંવા હૈ.

૬ સર પ્રમાન સદ્ગુરુપદેશના હૈ.

# શ્રી જૈનધર્મ પ્રકાશ

જાહેરો, મતુ જન્મ પાગી કરી, કરવા જીન વિકાશ;  
ગેર કુળ ચિંતે કરી, વાગ્ચો કેન પ્રકાશ.

કુસ્તક ૨૦ સુઃ શાકે ૧૯૮૯ સાં ૧૫૩૦ વૈશાખ. અંક ૨ નો.

## યુવકને ઉપદેશ.

ધાર્માલી લે ધાર્માલી લે, હરજ તારી ધાર્માલી લે; ધોચન મહો ધૂથા જૂદે, ઝાગટ શું રંકડા ધૂદે. ૧
કંઈ આયુષ્ય લાગો છે, એણે તું કાં યુભાવે છે; પરતાંતે તે ધરી થાશે, આતી જરમાળાંયો રહાશે. ૨
પઢી તું કેમ ધૂરી નશો, ગયા વિના શું રહેવાશે; સમજ શું આદા મર્જી, મતિ તારી થંડું બંધી. ૩
ગયા મોટા મદા રાયા, મુણો પર લીંધુ ડેરાયા; તેઓ પાસે તું શા લેખે, આવ્યો અવસર શું હવેણે. ૪
ચિંતામણિ જન્મ પાયો છે, આદેખે શું યુભાવે છે; ખાઈ પોઈ મરત આલે છે, પરતું દંધ ખોલે છે. ૫
પરસ્નોથા પ્રીતિ માંડે છે, કષાયથી સત્ય છાંડે છે; એવે તું હું ને ચાદં છે, સગર આતો શું તાદં છે. ૬

૪૬

## શ્રી કૈનથર્મ પ્રકાશ.

- પરગ ને ગુણ તારે કે, તથ શું દૂસરો જાઓ;  
અરે નાદાન પ્રાણીર, ખરી ભક્તિ ન ગણી તે. ૧૬
- પર ઉપકાર કર્યા ના તે; લારખગાં દિન ન રહે;  
નર આ જાંસદી ચાંચે, જરો હે કે એવે જાંચો. ૧૭
- દ્વા મનમાં ન રાખી તેં; છતી શક્તિ ન દાખી તેં;  
પીડા પર પ્રાણીને કરતો, ઉદ્દર પાણી પાણે ભરતો. ૧૮
- રિખાયે તુજ સાધર્માં, મળે ના ખાનરી બંધી;  
તને સારં શું ભાવે છે, જમ્બું તારં તે એને છે. ૧૯
- પુષ્કરે ધર્મ ભારો આ, ધરમનો મર્મ જાણે ક્યાં;  
ધરમના જર્ંગ મચાને છે, તડો તડ તડ પડાવે છે. ૨૧
- તેથી વારી સિથવિ શૂરી, તપારી નો લંઘ જોકી;  
ભાણે નિનરાજ કથાયે ધર્મ, ક્ષમાયે પામશા શિવ શર્મ. ૨૨
- પુદ્ગલતું સુખ ખ્યારં જ્યાં, આત્મિક સુખ ન્યારં ન્યારં ત્યાં;  
તથ થડ જાળાયે યાજે, તથ ફૂર ફૂસકી રંધે. ૨૩
- સમય અતુસાર વર્તી લે, સમયને માન આપી લે;  
સમાજિક ઉન્તતિ માટે, પરસ્પર વેર છેડી હે. ૨૪
- કુખારા પૃષ્ઠ છેદીને, સુધારા ખીજ રોપી લે;  
મળ્યું બગ વારે ફ્રારવિ લે, જેડી ફર્સ્તો ન ગેરી રેલ. ૨૫
- શરિ ફરિ જેગ મળે નાનો, કન્ભર કશીને લહે લાનો;  
ચંચળ લદ્ભી પડી હાથે, તો ખરચી લાભ લે સાચે. ૨૬
- અમર કીર્તિ ગળની જા, અવનિમાં નામ ગળી જા;  
વખત ક્રીણબ્ધીનો આ, કલમનું નેર છે જ્યાં લાં. ૨૭
- તીરથ પૂજનાં સંદર્ભો, જમણુવારેય જાણો તે,  
સુધારા ખીજ સીંચો લો, મેરા ફળ ફૂલ પામી લો. ૨૮
- આત્મ આમુજ હો લોકે, સાધન ચુણનાં જિતાવી લો;  
કહે નર હૃદ ચંદ ધથા, માને તો માનને મનના. ૨૯

धनपाठ.

२७

## अग्नतमोपदेश.

( गजल. )

साची सेवा जिनराजनी, जग इथनीमां तुं शुं रज्यो ? ,      १५०  
युक्त्यो नरी न बापडा, जल मंथनमां धृत ना भल्यो.      सा० १

सतिपात निटेपथी, विभाव लुंडा ना रज्यो;

वयन सुपा जिन प्रह्लाद पञ्चन, मंगशेणिया तुं ना गर्यो.      सा० २

इंधनां अभागीयाम्ये निक, अस्तिभावने ना कर्यो;

गाइखतामांहे युंचातां, गंभार गोथामां गर्यो.      सा० ३

उटाहे कुमतिनुं करी, कुमत मोहिनीओ छर्यो;

पींजरां पटीयो पूरतां, पाण्य पापी पथे ना पर्यो.      सा० ४

विचारी नेते भूण तारं, अलेख तुं जध क्यां चल्यो;

इर्षूर सुत सेवा स्विभारी, युर देव सेवा हुं इगे.      सा० ५

धनपाठ.

(अनुसंधान गृष्ट १२ थी)

जोजराजनी आगाथा देवभूम करवा नीकेला धनपाणे प्रथम लक्षा-  
नीना भादिरमां प्रवेश कर्यो. लांथी अकित थयो सर्तो अङ्कदम बहार नीकणी  
दूदना भादिरमां गयो, लां पाण्य आम तेम नेघ तक्षण भहार नीकणी  
विषयुता भादिरमां पेडो. लां योताना उतरीय वस्त्रो पडहो करीने बहार  
नीकण्यो अने श्री ऋषभदेवना जिनालयमां प्रवेश करी प्रशांत यिते पूजा  
करीने राज्बारमां आयो. राजनये तेनी पछवाडे हेरक मूँडेला हता तेनाथी  
राजनये सर्व इतांत प्रथमथीज नाइयो होतो, तेथी राजनये धनपाणने पूछ्यु  
'ते' देवभूम करी ? ' तेणु उंचु-'हा, भद्राराज ! समझ प्रकारे करी'

२८

## श्री ज्ञेतर्थसं प्रकाश.

राजनये भूत्युं-‘वाचानीनि पूजन कीरा विना अहित अहने तेना भंडि-  
रभांथी केम नीकलो? ’ धनपाणे कच्चुं-‘अधिकारे केमणेवा आयुर्वेद नेना  
दस्तमां छे असी, लवाट्यर यृदी राजवेदी अने महिनीन् भद्रन करवानी  
हिंसा करती बाचानीने नेहो वय प्रमाणे सोने कंपासाठ ४१३ नीकलो,  
तेमन दग्धाणा तो युद्धो सगा छे, पूर्वो सगा बल्लुनी नथी अग  
नियारीने तेनी भूत्य फल न करी.’

वाणी राजनये भूत्युं-‘ऐडनी पूजन केग न करी? ’ धनपाणे गोहो-

‘अकंठस्य केऽ कथं पृष्ठमाला ।  
विना नासिकायाः कथं गंथ धूपः ॥  
अकर्णस्य कर्णे कथं गीत नादा ।  
अपादस्य पादे कथं मे प्रणामः ॥ ? ॥

शीघ्रविंग नेहोते भें नियार कोंडे ३-४३ निनाना कंडमां पुण्य  
भागा शी रीते पहेरावानी? नासिका रडितनी पासे गंथ द्रग्न ते धूपनो  
उपरोग शुं करो? कान रडितनी पासे शुं नियारीने गीत वाच्य वगा-  
दां अने चरण विनाता हेय तेना चरणुगां भारे शी रीते प्रथुग करवा?  
आ प्रभाणे नियारीने भें तेमनी पूजन कीरी नवी?’

वाणी राजनये भूत्युं-‘विष्णुनी पूजन कीरा विना तेनी सन्मुख वस्तो  
पडो उरीते बलवी केम बडार नीकलो? ’ धनपाणे गोहो-‘विष्णु भेतानी  
स्वी लक्ष्मीने ऐणामां राणीने रहेवा लता, तेथी भें विंतायुं के लमणा  
विष्णु अंतमुरमां ऐडवा लमण्य छे, तेथी आ पूजनो अवसर लखातो  
नथी. केए सागान्य पुरा पथ न्यारे गेतानी स्वी गावे ऐडव लेय ते  
लारे सत्युरप तेनी पासे लता नथी, तो आतो नयु अंडना स्वप्नी छे  
तो अल्लारे तेनी पासे जरु भने युक्त नथा. ऐम नियारी दूरथीन भागे  
वाणीने भागे लता आवता ओडेनी दृष्टिनु नियारणु करवा भाए तेमनी  
आडो लस्तो पडो ईंगो.’

राजनये कच्चुं-‘गारी आवा इना ने कामानेनी पूजन केण करी?’

धनपाणः

२६

धनपाण ऐसल्यो—हे राजा! तमे हेतुमन करवानी मने आगा आगी  
हती अने हेवतनो गे नडाहेन स्वामीमान धीरु, तेथीतेनी पूल करी  
तेमना देवतना रवइपनु वर्जुन आ प्रभाषे—

प्रशापरमनिमयं, द्विगुणं प्रसन्नं ।  
बदनकमलमंकः, कामिनी संग शून्यः ॥  
करयुगमपि यत्ते, शख्संवंध वंधयं ।  
तदसि जगति देवो, दीतराग स्त्वमेव ॥ १ ॥

“प्रथम रथगां निभन नेवयुगा छे, प्रथम मुखारविंद छे, जोआ  
ओसंग रहित छे अने इस्तयुगा पशु शत्रुना संघाध वियुक्त छे,  
तेथी नगरमां वीतराग ऐसा हेव तो तगेज छे.”

वाणी धनपाणे कहु—हे राजा! के राजदेव युक्त खेल ते तो तेम-  
नामां हेवतनो आभाव खेवाथी अहेव छे. संसारतारकपथुं पशु तेम-  
नामां संबन्धतुं नथी अने हेव तो ने संसारथी तारे तेज खाई थडे. तेवा  
तो आ लोकनां एक जिनराजन देव छे; तेथी मुक्तिने भाटे युद्धिनामोग्ये  
तेज हेव सेवता योग्यां छे.’ आ प्रभाषे विविध प्रकारनी मुक्ति मुक्त धन-  
पाणां वयनो संबन्धाने बोलराज द्वेवमां संशय युक्त चितवाणो थयो  
सतो तेनी प्रशंसा करवा लाग्यो.

अन्यद निर्माती आद्यत्रीनी प्रेरणाथी राज्ञे यज्ञ उत्त्वा भाँडयो.  
ते प्रथमे अनिमां लेभवाने यगरक्षा आदये ए तेयार करेला बाकराने  
गोप्य फर्नो नेव राज्ञो धनपाणने पूछयु—‘अरे! आ ऐकडो शु कहे  
छे?’ धनपाणे कहु—‘मदाराज! संबन्धां, ते आम कहे छे के—

नाहं स्वर्गकलोपधोगरमिको नाभ्यर्थितस्त्वं मया ।  
संतुष्टस्तुष्टमल्येन मततं साधो न युक्तं तत्र ॥  
स्वर्गं यांति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो ।  
यज्ञं किं न करोपि मातृपितृभिः पृत्रैस्तथावाद्यवैः ॥ २ ॥

२०

## श्री कैनधर्म प्रकाशः

“हुं स्वर्गेना सुभ लोगवयनो रसीजो नथी तेगन गे तेव गाँडे  
तमारी पासे प्राध्यना करी नथी, हुं तो निरंतर यास भक्षण कसा वडेन  
संतुष्ट रहुँदु, तेथी अरे लवा आणुयो ! आ (अने अनिमां लोगी हेवतु)  
तमो परतु नवी. अने ने तो यगामां लोगेला प्राणीजो विशेष स्वर्गांनं  
व्या ले दो तां वगारा गाळा, निवा, अंगावया लापांनो लेवासाठी पण  
शा भाटे करता नथी ?”

आ प्रगांडे सांगणी राजन आतःकरणां डोपायगान व्या इनां गेला  
रवेला. एकदा राजन्यो एक गेंडुं सरोवर करावुं ते वर्णाकलामां संगृहीत  
राघ अरेलुं सांगणीने यांचें पंडितो विग्रेथी परवर्ती सतो राजन लोवा  
माटे गेले. लां पंडितोंने गेल योतानी युद्ध अतुसार नवा नवा झाल्यो  
वडे ते सरोवरतुं वर्षुन कऱ्यू. धनपाण तो भानज रखेला. पछी राजन्यो धन-  
नपाणाने कऱ्यूं-‘तुं पशु आ सरोवरतुं वर्षुन क२-’ एट्येते गेल्यो—

**एपा तडागमिषतो वत दानशाळा ।  
मत्स्यादयो रसवर्ती प्रगुणा सदैव ॥  
पात्राणि यत्र वक सारस चकवाकाः ।  
पुण्यं कियद् भवति तत्र वयं न विद्धः ॥ १ ॥**

“आ सरोवरना भिन्ने दानशाळान करी हेय एम लागे छे, नेमां  
भाजकां विग्रेरे रसेह निरंतर तेयारन हेय छे. तेमां दान लेनारां पात्र  
णगका, सारस, चकवाक विग्रेरे पद्धील्यो छे, पशु तेमां पुण्य शुं थाय ते  
हुं नाणुतो नथी.”

आवा धनपाणानं वयनेही राजन आवंत डोपायमान थेलो सतो चिं-  
तमां एम वियारवा लाभ्यो-‘अडो, आ महा दुष्ट नस्याय छे, भारी क्षी-  
र्तिनां करणु आनां नेवने पशु सुभ आपनारां थतां नथी. आ वयनेहीन  
ओणाखाच आवे छे के आ भारो युद्धेह देवी छे, नदीतो यील विप्रोंमे  
भारी प्रशंसा कर्त्ता छतां आ पोतानो थधने भारी निंदा कैम करे ? दुवे  
हुंज एनो डाढक रीते प्रतिकार करीस. तेमां यीले प्रतिकार करवानी कांधी

ધનપાળ.

૩૭

જરૂર નથો, માત એના એ નેત્રન કદમી થડું એટિકે પણ્યું.' આ પ્રમાણે ગતમાં નિશ્ચય ઉરીને રાજ મૈન રહ્યો.

પછી રાજ લાંબી પાણી નગરમાં આવતાં જૈયામાં આવ્યો, અટાનામાં એક ડાઢી ઓછીનો દાથ પકડીને ચાલી આવતી સામી ગળા, તેને જેઠને નાન જોઈનો-'દો નિદાનો!' ગોંગણો-કરકાળે સિર ખંગે, પુણી છા કંદુમ! ' તે સાંગળા ડાઢ નિદાન જોઈનો-'હાકારંતા યમ વાડી, નાંકાર કરેધ?' તે વખતે અનસરતે જીણુંના ગાંગે ધનપાળ પંડિત જોઈનો-'હે રાજન્ય આ રદ્દ કરે હાંદ કરે છે' તે સાંગળા—

કિં નંદિ: કિં મુરારે: કિમુ રતિરમણ: કિં નલ: કિં કુવેર: કિંવા વિદ્યાધરોસૌ કિમય સુરપતિ: કિં વિધુ: કિં વિધાતા । નાયં નાયં નચાયં નખલુ નાહિ નવા નાપિ ચાસૌ ન ચૈપઃ ક્રીદાકર્તૃ પ્રવૃત્તો યદિહ મહિતલે ભૂપતિર્મોજદેવ ॥ ૧ ॥

"શું આ નહિ છે? શું દૃષ્ટિ છે? શું કામદેવ છે? શું નગરાન છે? શું કુષેરભાંગરી છે? અથવા શું કોછ નિદાન છે? શું ઈદ છે? શું ચંદ છે? કે શું થદ્દા છે? આ પ્રમાણે લોડી ડાઢીને પૂછેછે; લોરે ડાઢી દરેક પ્રભના ઉત્તરમાં નાતા કહીને કહે છે કે તે કોછ નથી, પણ આતો કીડા હરવાને નીકેદો આ પૂર્ણિતળનો રાન બોન્ડેવ છે.

આ કાવ્ય સાંભળાને અત્યાંત હાર્ષિત થયેલા રાજને ધનપાળને કહ્યું-'શું તારા પર તુષ્ટમાન થયો શું, યયેચિત વર ભાગ,' તે વખતે ધનપાળ સરોવર વધુનના પ્રસંગે રાજના ચિત્તમાં થયેદો માડો અભિપ્રાય જોતાના ઝુદ્ધિલાયી જાળુને જોઈયો-'હે રાજ! જો મને વાંછિત આપતા હો તો મારાં એ નેત્રો પ્રસન્ન થઈને મને આપો.' ધનપાળનું આવું વચ્ચન સાંભળાને રાજ અસંત વિસમય ખાંઘો સતો ચિંતનવા લાગ્યો-'ને વાત મેં ડેઢની

\* આમાં રાજનો પૂછ્યું 'લાયને કપાવે છે' ને ભરતકને ધૂણ્યાવે છે, તથી આ પુણી શું કહે છે? 'એટિકે પણ્યું-તેના હંકારતા એવા ને જમગતના શુભયા તેને 'નાતા' કહે છે.'

३२

## श्री जैनधर्मी प्रकाश।

मारो प्रकाशित करी नथा ते आजें शी रीते नाणु ? शुं आना उद्धारां  
क्षांच सान वर्ते छे ?' आ प्रगाञ्जे विचारी यादु प्रकाशना सान सन्मानाहिते  
धनपाणने पूछते रान्नां पूछ्यु-तों मारो अभिप्राय केस नालो ?' धन-  
पाण ऐहो—'जैनधर्मीना शेवत थडी प्राप्त येवा "युद्धाणी।' आ प्रगाञ्जे  
सांभागीने रान्नां जैनधर्मी प्रशंसा करी।

धनपाणे प्रभ्यात जैनधर्मी धर्षां वर्ष पर्वत परिपालना करी असे  
आद धर्म विधि प्रकरण, उपर पंचाशिका विजेते थंथ्या रस्या। जैनधर्मीनी  
पाणी बनवि करी जे प्रगाञ्जे ७ यतना पूर्वक सम्यक्ताहि धर्मन् यावल्ल  
सित प्रतिपादन करी प्राप्त याविं लाई मनपाणा हेताङ्गाने आमो।

६५ धनपाण वृत्तांत।

## एक जैन मुनिए लखेल पत्र।

आपको यह रुद्याल रहै कि और किसी मत मतांतरका  
झगड़ा नहीं है फकत जैनमतके शास्त्रानुसार पूजेरे हुद्दोकाही  
झगड़ा है तो आपके समक्ष यह निश्चय होना जरूरी है कि दो-  
नोंहीं जैनी कहाते हैं परंतु इनमें असली जैनी कौन है और न-  
कली कौन है। इस बाबत बहुत वातोंका आपसमें फरक है तो भी  
जेकर नीचे लिखी थोड़ी वातोंका फैसला होजावेगा तो वाकीका  
आपही होजावेगा।

? जैनमतके शास्त्रानुसार जैनमतके साधुसा भेप केसा होना चा-  
हिये अर्थात् साधुको कौन कौन चंगि जरूरी चाहिये और  
किस किस कारणके वास्ते रखनी चाहिये जिनमें ऊनकी कि-

तभी सूतकी कितनी इत्यादि। इसमें इस बातकाभी निर्णय हो जावेगा कि मुंह दिन रात वंधा रहे या खुलाही रहे।

२ दिशा पिशाच होकर शुचि करनी चाहिये या नहीं। यदि करनी चाहिये तो हुंडिये साधु रात्रिको विलकुल पानी नहीं रखते हैं जब दिशा पिशाच होते हैं क्या करते हैं।

३ ज़रे वर्जनोंका पैला पानी साधुको लेना योग्य है या नहीं ? हुंडिये पैला पानी लेते और पीते हैं। आम लोग जानते हैं। बल्कि श्री गुरु ग्रंथ साहिबमी फरमाते हैं कि—शिर खुलाही पीए मलवाणी जूटा मंग मंग खांही। फोल फदिहत मुख लैन भडासाँ पाणी देख संगाही ॥ इत्यादि—सो यह काम करना किस जैन शास्त्रमें फरमाया है।

४ शास्त्र कितने मानने और उसमें क्या प्रमाण है। निर्युक्ति भाष्य नृणि टीका वर्गीरह प्राचीन अर्थ मानने या नहीं। व्याकरणादिका पढ़ना योग्य है या नहीं। यद्यपि हुंडिये इन बातोंको नहीं मानते हैं परंतु जैनशास्त्र क्या फरमाता है सो देखना योग्य है।

५ सूतक पातक मानना धाहिये या नहीं; साधुको उसके घरका आहार लेना योग्य है या नहीं। हुंडिये इन बातोंका परहज नहीं करते हैं आम मशहूर वात है।

६ जैनपतके शास्त्रानुसार गृहस्थीको स्नान करके शुचि होकर इष्टदेवकी सूर्चिका पूजन करना योग्य है या नहीं हुंडिये इस बातको याने सूर्चिपूजाको बहुत बुरी समजते हैं।

इस्ताशर—जैनी साधु-

श्री कैनाधर्म प्रकाश

## जिनेंद्रपूजा.

पापं लृपति दृग्यति दलयति व्यापादयत्यापदं ।  
 पुण्यं संचिनुते श्रियं वित्तनुते पुण्णाति नीरोगताम् ॥  
 सौभाग्यं विदधाति पञ्चवयति प्रीति प्रसूते यशः ।  
 स्वर्गं यच्छति निर्वर्तिंच रचयत्यर्चाहृतांनिर्मिता ॥

(सिंहर भक्तिषु.)

जिनेंद्र पूजनो विषय बहु अगल्यो छ. जैन भ्रागमां गेयो पक्ष  
 न्यारे सर्वे प्रकारनी पूजनो स्तीकार करे छे त्यारे अमुक जैनडेख अमुक  
 प्रकारनी पूजन आद करतां आषाढीनी पूजनो स्तीकार करे छे. पूजन ऐ प्रका-  
 रनी छे; दृव्यपूजन अने भावपूजन. दृव्यपूजन एट्टेपे प्रभु पूजन सार उत्तम  
 द्रव्योया तेमनुं सन्मान करुं अने ते सत्कार साथे प्रभुनी बुद्धी बुद्धी  
 अवस्थाओपर विचार करेयो. जैनभार्गमां शुएक दृव्यपूजन नथी. हरेक दृव्य  
 निभिते भावपूजन अंतर्गत व्यक्त छेय छे अने सर्वे द्रव्यवावपूजन  
 उपर करारेप आस भावपूजन करवानो उपहेय अते कर्तव्य अने वर्तन  
 पथ तेबुन्ज छे. पूजनो आ उत्तम प्रकार छे. शिष्ट संप्रदाययी चाल्यो  
 आवे छे अने प्राप्तो ते भार्गते अवुना पथु अक्षरशः अनुसरे छे.

जैन भार्गमां उटेलाक स्थूल दृष्टि अनेने दृव्यपूजन इचती नथी. शास्त्राधार तेओने भटे अगाडि बहु घतावाध गयो छे अने दावमां विद्वान्  
 भद्राशयो तररथी व्याप्ति उत्तमां ते संबंधमां पूरतुं अज्ञातुं आ-  
 उत्तमां आव्युं छे. तेथी आ प्रभुने शास्त्राधार दृव्यपूजने अनुदृष्ट छे के  
 नदि ते संवाद आव्यु उपर मुझी गाव अदारना प्राहृत विचारीन आ  
 संप्रदा उपर विचार करवानी स्फुरण्णा थध छे. शास्त्राना इरमान तरर  
 विचार न छीसे तोपथु अरामर विचार करवायी ज्ञानायी के दृव्यपूजनानी  
 आस ज्ञर छे. आ ज्ञानानामां हरेक बायत उपर विचार करवानी आव-  
 ध्यक्तां छे, क्राध पथु आयत जैनशास्त्रमां आथकी इरमावेकी नथी, असुरा

જીને દ્રવ્યપૂજાની કટકી જરૂર છે અને આજમાનામાં પ્રદૂતિનાં જીવન થ-  
નાથી ઉપરોગીતા વિષે છે કે ધરે છે તે બાયતપર વિચાર કરવાની ખાસ  
જરૂર છે. આ સનાતન દ્રવ્યપૂજાના પ્રશ્નાનિભિત્તિપૂજા પર વધારે હીની  
જાત છે અને તેથી તેની આવસ્થકાતાપર વિચાર કરીએ.

૩૫

૧ અલાર સુધીનાં કોઈ પણ પ્રનાળે મૂર્તિપૂજા વગર ચલાયું હોય એમ  
છત્રિદાસ ઉપરથી માલુમ પડતું નથી. દેરેક પ્રન એક અથવા ખીલ રૂપમાં  
મૂર્તિપૂજા રીકાર્દી આવી છે. જ્યારે મૂર્તિપૂજા ૬૬ ખાદીરન્ય છે એટસે કે  
મૂર્તિને ગૃહિ આતર પૂજાનાનું થાય છે લારે તેમાંથી જુદો વિચાર જીતાન-  
નારા કોણો નીકળી આવે છે, પણ આવા કોણો આસ કરીને આગળ વધી  
ગયેલા વહેમપર અને નહિ કે મૂર્તિપૂજનપર આક્ષેપ કરનારા હોય છે. સારાં-  
શાશુદ્ધે વરસ પહેલાં યોડાક હિંદુયનોએ મૂર્તિપૂજા વિરદ્ધ વિચારો જીતાન-  
વ્યા છે અને હાવ તેઓ 'પ્રોટેસ્ટ' પંથના ડેહવાય છે, પણ તેઓના વિ-  
ચાર ગાન દેખાવમાંજ મૂર્તિપૂજા વિરદ્ધ લાગે છે, પણ વસ્તુતા: તેમ નથી.  
તેઓએ ને મારી લીધી તે મૂર્તિપૂજનને અંગે વધી ગયેલા વહેમો તરફ  
પોતાનો તિરસ્કાર જીતાના રૂપ દોંઠો. આ ઉપરાંત સુસદ્ધમાન અને જ્યુર-  
દોકા મૂર્તિપૂજા વિરદ્ધ હોય એમ દેખાય છે. આપણૂં હિંદુસ્તાન વરદ  
નનર કરીએ તો આપો દેશ મૂર્તિપૂજક છે.

૨ ડેટલાક નાની નાની ડેઝ યા સમાજના કોકો આ બ્યાખતમાં હાથમાં  
વિરદ્ધ વિચાર જીતાનારા નીકળના લાગ્યા છે. હાથલા તરીકે શીખ, આર્ય-  
મસ્માજ, અદામસ્માજ અને પ્રાર્થનસમાજના કોકોએ અતિ પરાણાએ પહેં-  
ચેલી મૂર્તિપૂજા દૂર કરી છે. કેનેન કોમમાં પણ ૨૦૦ વરસ પહેલાં દુંદુક  
કોકોએ કૈનતપૂજા કાઢી નાંખી છે, પરંતુ તેઓ બહુ એધી દુદમાં દૂર કરી  
શક્યા છે. આગળ જતાં જણુંશે કે તેઓનો મત મૂર્તિપૂજા વિરદ્ધ નથી  
અને હોઈ શકે પણ નહિ.

મૂર્તિપૂજા વિરદ્ધ પ્રસંગે પ્રસંગે આવા વિચારો જુદી જુદી પ્રનાલે  
જીતાન્યા છે, જ્ઞાન પણ મૂર્તિ વાપરવા માટે દરેક પ્રનાલે વારંવાર કેવી વલથ્ય

૧ See C. H. C. Magazine Vol. I. P. 65. ૨ યાહુદી

ભતારી છે તે જાણવા જોગ છે. જણું કોડાને તેઓનો અર્દ્ધ છે, મુસલમાનનોંઠે કાણાનો માન આપે છે અને શીખ પ્રનાને થંથ છે. વાંચી ડોધ પણ હોય રથું મૂર્તિપૂજા કાણું ફરતી ન હોય તે પણ આજાણુંપણે માનનીસા મૂર્તિપૂજા તો સ્વીકારે છે॥

સર્વ પ્રનાની આરી વરણું કુદરતી રીતે હોનાથી મૂર્તિપૂજામાં હોય જોંથી પ્રકારનું રહ્યા હોય નોંધને કે તો વિનારા॥ પ્રેરા હોય જોંથી નોંધી આપણું હેઠળ વારાની કાણું નોંધને. ગૂર્હા જોંથી શું ? આ ચારાં રાજ્યાં કિં છે; મીરીએ એની ઔદ્ઘાન્ટ કંદે છે કે An idol is an image which shows symbolically some attributes or group of attributes of the Supreme Parmatma. કેટલાક જાણું જુદુસમૃદ્ધને દૃષ્ટારે જાતો હે તે મુર્તિ. પરમાત્માના ગુણો નોંધાવું જોંધની વિકાસ પણ જોંધો નોંધાથી દૃષ્ટાત્મ હોય પરમાત્મા ગુણ નજરાત્માં જાતો, તે વર્ણાન જોંધાયા, સ્વભાવિક રીતે તેવાર મલા જાણ જોગ મુર્તિ. આજા પ્રકારની મૂર્તિને નોંધાથી, વાંદાથી શું વાબ થાય તે હોય નોંધનો.

એટો પ્રસ્તિદ વાત છે કે આપણું મત સંચેતને વચ્ચે દર્શાવ્યા હોય છે. ચાનું સખત દરીયાધના જમાનામાં અખંડ પ્રતિગાં ગડેવા આ છીએ પરમાત્મા હોણું છે ? શું છે ? કેવા છે ? કિંદે વિચાર કરવાનો આ વધાશ ભગતો નથી. ધંધાણી બેંડ હેઠળ અને તલ્સાંદી પ્રાચણિક વિના-રોમાં આ જરૂર સાચારથી રાત પ્રેરિત ચંચાએ છુણ ગૂણી કરે છે. કેટલાક નિર્દ્ધારી જીવો તદ્દન પ્રમાદયોજ અનુ પૂર્ણ કરે છે. આ જન્તે પ્રકારના જીવોને તો પરમાત્મા સંગંધી વિચાર કરવાનો કાંઈ પણ આરક્ષણ સંગતિ હોય તો તે મંહિરમાં મૂર્તિ સંમુખન છે, ધાર્યા જાણ જીવોને પરમાત્માનું સ્મરણું પણ મૂર્તિપૂજા વગર થય શકતું નથી, જો અવસોદન ઉપરથી રૂપ જણ્ણાએ આવ્યું છે. કેંમ કોણ સંગ્રહ આગળા જાવનો જીવ છે, તેણ નંબ આ આયતની વિચારણા અને લક્ષ્ય વિશે વલદર ધરનતારું શું જાય છે અને આવી રિચ્ટિ હોનાથી આપણું પરમાત્મા તરત ધાર આપ-નાર તરીકે પણ મૂર્તિપૂજાની ઉપરોગીતા જાણ્ણાય છે.

દરે જીછ જાન જો ધાર કરવાની હેઠળ આપણું મત "આ અદ્યિતર છે,

## જિનેં દ્રોગ.

૩૭

એક પાયત ઉપર પાંચ મિનિટ સિથર ચિંતા કરવાનું સૌંપવામાં આવે તો આચચે જરા એવું સિથરસા રણી શરીરે નથિ; એટલે કે પાંચ મિનિટ સુંધરી એચ આદરસી ડેંડ પણ પાયત ઉપર લક્ષ્ય પણું ન આપીએ અને આપેલી આચચ ઉપર તહું બોકાયતાથી વિચાર કરીએ એ બનવું ખાલું સુસ્કેલ હે. અચ્છી માનવિક અધિયસ્તા કોણાં તો સિથર કરવાનું કારણું કંઈ પણ નોંધશે. તથવા તરીક વાક્યના વાચ્યાપર એક માણુસ બાંધી વાતાં સુંદર વાતાંનો કંઈ નથિ તો નોંધી આચચનું જરા એવું આગાર શરીર નહિ, પરંતુ પણ જરારે હૃદય ઓંદે આચચની રણુણ રહું કરે લારે અણું વિષણ કર્યા એ ચાર કાઢ શરીરી બોકાયતાથી ધ્યાન આપવું હોય તો એવું આપી શરીરની છુંબન, આ પણ એ પરમાત્માની વિગેર અણિયોનું જિતાકરોક વંબિત આપણનાં શારીર આચચા કરળાના કરાગાં આંદે, પણ શાંતસૂર્યિ પરમાત્માનું પ્રતિભિંપ કંઈને લદાપર હે આસર થાગ છે તેણી અસર abdication (ભાંવના)ની શરીર નથી. ગણુણ જળ સ્વયામ અને ગતના અવકોણ કરનારાઓ વોનું શકે છે કે ગણુણ ગતની આ નાણાના આગું છે; પરંતુ મનોધ્યા અને શરીરણ કે કે તેજ છે અને સંઘણીનાણાદ્ધમાં વધારો થતો જય છે અને અગ્નાર સંઘયથું થવાનો સાંગન બોલો થતો જય છે, તેથી મનને અને શરીરને જોડી હોય, બાબાદૂષિ ભૂતાત્માર, બોકાયતા કરાતનાર અને વચ્ચાનાંથી આત્મદો અતુભાવ કરાતનાર સૂર્યિ નેવું અવલંબન થા માટે તથ હેવું એ સમગ્રતું નથી. નરોએ અવલંબન વગર ધ્યાન કરી શકતા હોય, ગાંધીય ભાષામાં કહીજો તો નરોએ સાતમા અપ્રમત્ત યુષ્ટસ્થાનકથી આગળ ચાલ્યા હોય અથવા અપ્રમત્તાની હોય તેઓને માટે બા વિષય નથી; પરંતુ ઉત્ત પ્રકારના માણુસોએ આ કાળમાં પ્રાયે હોય નહિ, તેથી આક્રોના માણુસોએ તો સૂર્યિસુલ મૂડી હોયથી ધર્મ પામગાતું પ્રાય સાધન સૂરી હોય નેવું કરું છે.

તથી ડેંડાક માણુસો સૂર્યિપુન ભાનતા નથી તેઓ એવું ભૂત આપ છે. જ્યારે ધ્યાન કરે જારે તેઓ શું કલ્પે છે? જાત દર્શિન ચારિની બોકાયતા તે આત્મા-પરમાત્મા-ચિહ્નાન સરસ્પ-પરમ જ્ઞોતિ વિગેરે આપું ધ્યાન નન્દો કરી રહે કરી શકે? જેઓને ભાતના હૃદ અદરસ્ય પ-

दार्थात् रमणु करात्ती देव न तेजा अने तेजोंने गतोऽग्नि च न तेजा  
तेजोंने छांग आपार-टडा नेम्पज्जे; नहि तो आच्युतावना बाहुना निर्मल  
पर भन देववाह जय छे. आथी करीने तेजों सामरण्य रीते केलांग बाग-  
बाहुना भूतिगर निकारनी स्थिति के जेती केल गच्छ स्थिति बाहुमां कह्यो.  
आग चवाथी तेजों भानसिक पूर्णना अभिवाही थया. अने गानसिक  
मूर्तिगृह भाननारथी कठीण स्थूल मूर्तिगृहनी ना खाई शक्या नही. वारी  
गानसिक मूर्तिगृह भरार केवलीकर गंधे वृद्धानो खाए ले. तेजों गो-  
तानी गानसिक मूर्तिनी अरेघर परमात्माज समान्त छे, ज्ञारे स्थूल मूर्ति  
गाननार गोतानी गर्तिने परमात्म लाइप भवानार, १ रमानानार, कठिपत  
भारेप तरीकेन गाने छे, चराक्के छे. आथी करीने के वृद्ध गानसिक मूर्ति-  
गृहक होइ ऐ ते वय स्थूल मूर्तिगृह भर्नार कठीण कर्तो नही.

आगारा केटवाक बाध्यों परमपरागत पैंग प्राप्ति आई आगारा गुंग  
पूजने भान आपता नथी, तेजानी धार्मिक वृत्ति ज्ञारे निर्छो छाँजे  
लारे मूर्तिगृहनी उपयोगीता ज्ञानुष्ठ आने छे. उपर ज्ञानुष्ठ तेम आवा  
प्रभारना लोडेने धर्म थुं छे तेनो पछु निचार आवतो नथी. जैदिक सुअ,  
तेना साधतो, पाणा पडवाथी शोड अने संसार यातामां अवन पूर्णु कर-  
नारते आ उल्कृष्ट साधन आदरणीय छे.

प्रसंग कार्तिक मासनो होतो. शरहक्कु उतरवा आवी हती. गोभासुं  
हितरी गसुं हतुं. सर्व वनराण धीली रही हती. आयुं जंगल, तेनो लीलो  
हेखान भनने अने चक्षुने शांतिनो आगास आपता हता. वक्षे आनंदमां  
आणी पेताना अण इप्पी हस्तो लंबावता हता अने पक्षीला पेताना  
भाणाभांथी हुता हतां. सभय प्रभाततो होतो. उद्यायण तरइ सुप्तो अरण्य  
सारथी दिशाओने प्रकाशतो होतो. आकाश स्वरूप हतुं. आना अर्पांड शां-  
तिना वर्षतमां एक सुख्खु लाथमां पुण्यनी छाणी लह सुंदर वक्षेपरथी  
भूर्यु धीकेला शुद्धाय, देवकी, चंगो, सेवती (शुद्धतवदी) विग्रेरे शुद्ध पुण्योने  
वीर्यु देतो होतो. वीर्युने पुण्य पावतां शेपन करतो होतो अने गनगां  
परमात्मातुं ध्यान करतो होतो. तेना गतमां परमात्म भाव विवाय डोइ  
पछु प्रकारतो विक्षेप नहुतो. योउ वर्षतमां पुण्यपात्र विविध पुण्यथी भरी  
देवासर तरइ चालना भांडयुं. देवासरे आवी शुद्ध वल्लभी स्तान करी पुण्य

## जिनेदपूजा.

३६

कामार तुवा पाड़ा अने तेनाथी परखर भरवा 'मांडयुं' वर्चे वर्चे गु-  
वाण मुहों। पहुंचे गोगरो अने क्रेपार लीला गो अने धाने छेडे पी-  
ला गोंगा नम्बो वर्चे गेवला अने जो तस्व भोगरो मुहों, पहुंच प्रभु  
सन्मुख आणी शुद्ध व्याप्ति नदवथु करी सुरव्युपत्रथी आंगा करी परखर  
गडावी मुगुरमां अने प्रभुशरीरपर पुष्प चडाव्या, शेभती जगोओ, वर्ष्यु  
बतरथा अने ज्ञातिक्रमवार उपर नीचे अने पहें पुष्प घरा करी दीधी,  
आ वात कांति अज्जन आनी रखी, पुष्प विशेषे पूजा करी प्रभु पासे ऐ  
गोंगा दावीर ऐ व्होति युक्त हिंा कांगा अने ऐ नानी आनोडीपर णीनत  
ऐ हिंा करी, आ हिंानी न्हेति, प्रभुना कांति अने पुष्प आनरसे भ-  
प्राप्तार चंसनी जोकामता गाप, देवसरगां तदन शांति दती, प्रभु सन्मुख  
गेही लारिका करी इण मेवेव परी शांत अने एकाम चित, करी गान  
गरवा गांगा.

प्रीतलडी व्याख्याण्डीरे ग्रहुत लघुंदशुः  
प्रभु पापे घडी एके भन न सुखायले.

... ... ... ... ...

करुणांशुकि कीधीरे सेवक उपरे,  
लप लय लावड लांगी लक्षि प्रसन्नले.

सुखर साये धीमेथी नेम नेम आ अवान चाल्यो, तेम हृष्यमां  
नेंद थवा लाग्यो अने ने वर्खते लारकता तुज मांडिरे अवष्टु सांबलां  
जे पह गाया पंडी 'लप लय लावड लांगी' ऐ पहनो सुंदर ध्यनि  
हृष्यविष्णुआंथी उठ्यो, ते वर्खते हृष्यमां भरेभर लास्युं के आ संसा-  
रनी ऐडी अलारी नाश भागी, अहाहा ! शुं हिंय स्थान ! शो अतुभव !  
गेहो गूर्तिपूज विश्व द्वाय तेहो भवे दसे अथवा गमे तेम घोल, पथु  
आ अद्वाकि आनंद-दुःखमय उवितव्यमां आ सुखनी रेख-ग्रेमय  
अवनो ६६ छ. हृष्यना एकतानथी अटापदभर गान करता रावणे  
तीर्थेकर नाग कर्म करी रीते गोध्युं तेनो जरा घ्याव आव्यो अने मूर्ति-  
भूजतुं पुष्ट आवंभनत अगुभव जोयर थयुं, एकवार मूर्ति सन्मुख जुओ,  
आंग गीओ, भनमां तेज मूर्तितुं ध्यान करो, तेवीज मूर्ति कर्ते, इरी आं  
ए उवाडो, गूर्तिमां स्थापित शुग्यो ऐली जग्यो, आंग वृंद छरो, मूर्तिने

कहो, गुणोंते कहो, सूतिने भूली नजों अने गुणोंते कहो अने तेना पर शिक्षयता करो, आज कर्तव्य अने मेहम सावनों सरस्य कुपाल.

कल्पना शक्तिसे आरटी कह सुनी लग गया पर्ही एक आगामी पर वहाँ ध्यान आपनानी बहर के, कहो रथानकारीओं गुर्तिपूजन विद्वन् ओ जेम भाने छे तेजो रक्षस्य सभन्ना नहीं, तेजो गुर्तिपूजन विद्वन् कीरण्य लेह शकेन नहि, करण्य के तेजो अहु रीने गुर्तिपूजन भाननामा के, वहाँ अरजेमांतुं एक धरण् एं छे के तेजो शाश्वती प्रदिवा भाननामी हा कहे छे, इवे सहज दृष्टिया जल्यों के शाश्वती प्रतिमा एं पर्ण प्रतिमान के, तेजो तेजो गुर्तिपूजन विद्वन् तो छेज नहि, इवे साव आदी जेव रहो के गुर्ति केवा भाननी अने तेजे योग्य सामयी केवी राणी शक्ता ? आआगामी नं नं मतभेद छेते भूल लक्ष्मीतनुं रप्त बान न थानथी श्रेष्ठो के, के लोकों आधिष्ठ एक प्रभानी गुर्ति रवीकारता लेय तेजो पर्ही गुर्तिपूजन विद्वद लेवनों द्वयों की शके नहि, ज्यां परमात्मपर्णानो आरोप करवो छे लां पर्ही आरोपित वस्तुनी शाश्वता अशाश्वतानो संबंध नेवो उपर्युक्त नहीं, आरोपित पर्णाय आरोपने योग्य, वीरसथायी, परमात्मगुण्युं बान डेवतनार अने प्रभोद करये तेवो निमेंग लेखुओ, परंतु आवी व्यतस्या निगेनी सागान्य लक्ष्मीकारथी गुर्तिपूजन विद्वद विचारो अताचनानी ने दिग्बत करवागां आवे छे ते तहन अस्थाने के, अयोग्य छे अने वस्तुक्षितिना गान अने जन-स्वभावना अवदोक्तनी गेरहाजरी घताचे छे, धर्मनो बास रहेवा आतर पर्णु अनादिसिद्ध गुर्तिपूजननी आस बहर के, वगा यीक्षणी द्वीप करतां एक वात आ जमानामां अहु ध्यानमां राजवानी बहर के, आ समय अहु अगलयों छे, असारे पाञ्चमाल विचारो साथे गूर्हना अनोऽलांगा वर्षतर्हा यावता आवेदा तुना विचारेत्यु संघटन थाय छे, आ वर्षते ने विद्वनोना दायमां धर्मतुं सुकान लेय तेजों धर्मना अवलंबन नेवा लागता सर्वे साधनोने गव्यायुत जनानी देवती अहु बहर के, अवारे धर्मनो आनाय वन्वारे देखाय छे, पर्णु नेवो शांतिया एकांते विचार करता हरो तेजो नेह शक्षे के भूल पाया आवाई जता ज्य छे, आ पायाने गव्यायुत करवानी अहु बहर के, आवता जमानामां धर्मज्ञावना अने संसारभावनाने गव्यायुत लगाई थवानी छे अने ते प्रसंगे ने धर्मना साधनो लुडा थम गया हरो तो धर्मनो उडो वागनो आटडा ज्ये आवा अहु अपायु अनि

## जिनेद्रपूजा :

४१

४२रो. अस्तारे पञ्च अवान भंड थनो नय छे. पञ्चम काणगां धर्मना साधनो ऐश्वर्या शाळानुसार के नदव्यातुयोगनां स्पष्टीकरण (exposition) विजेती नेटवी नदर छे तेष्टीज नदर मूर्तिपूजनी छे. कारण आ काणगां आ ऐगोन आमार छे. अगारा देव लाल्हगोने हड्डेवानी नदर छे के आवा सम्बन्ध गंद पाडागां इतिःय युक्त छे ए जेह लेवानु छे. न्यारे पक्षगोह आने आयह छाडी आ आयतपर विचार करवाभां आवश लारे उपरनी साठी द्वीवानी आवराउता समझ शकारे.

मूर्तिपूजनी नदर छे ओम नीवा पठी पूजना प्रकारपर विचार द्वीये. पूजन ए वाकरनी छे. ओक द्वयपूजन अने थीछ भावपूजन द्वयपूजनमां उंचाम पदार्थो जेवानी पञ्च सन्मुख परवा. द्वयपूजन करती वजत लाल्हशुद्धि यहु सारी राखावी. आचार अने विचारने यहु नल्लतो संबंध छे. आल्ह शुद्धि वगर गतमां ग्रेम पञ्च आवतो नव्ही. आटे शास्त्रमां जतावेली रीति प्रभावे नहाई स्वयं थहु शुद्ध वजत पढेवी अष्ट, सप्तर, ओकवीस प्रकारी प्रूज करती. पूजा दरम्यान अंतर दहि भावना तरइ शाखावी. दरेक पूजा वजते आ अमुक अवस्था भाववानी छे, ते भाववी अने पञ्च जेवा थवानी इच्छा राखावी. परगातम लेवानु दृष्ट ए छे के वरापर ओकतान थाप के आ अनु परमात्मेय थर्त नय छे.

भावपूजनमां पञ्चुनी सिद्ध अवस्था भाववी. आ आत्माने परगात्मतर साये नेडी देवो. निर्दिशात्माव तथु देवो. विचारनु उ सर्व शुद्धा आईं भरेवा छे, थीम पासे देवा ज्वा पडे तेम नव्हा. आ शुद्ध प्रकट करवने कर्म तोडावानी अने ते गाए धानाजिन सजगाववानी नदर छे. प्रभुतुं ध्यान करनां करतां आवी उत्कृष्ट भावना, रांसार निर्देश अने आत्माना शुद्ध शुद्ध तरइ विचार करवो. वली भदान् पूर्णाचार्यो रथित स्वतन्त्रडे झीतन करनु. नेवाने बाडितसपर ग्रेम देय तेने गाट पंडित श्री जेष्ठनविजयल, रामविजयल, भानविजयलुना स्वतन्त्रो यहु आनंद आपनारा थश अने नेवो उडी शीक्षुरी अने द्वयातुयोगपर ग्रेम लेय तेवाने आनंदधनल, द्वयद्वलुना स्वतन्त्रो उपरोगी छे. उपाध्यायलुना स्वतन्त्रो अने वर्गने ओक सरप्तो लाल अने आनंद आपनारा छे. आवी रीते पञ्चना ध्यानमां लीन गद्ध भावपूजन करती, जेवो आनंद करतो के तेवो ओउद्धार-तेनी छापा-

४२

## ओं जैनधर्म प्रकाश.

तेवी गीतार्थ गांगाभा द्वित्रे सुधी लक्ष्यरां रहे; कर्ता द्वयारांने गो ओकडे  
मुळवा नेतु लागलं देख तो तेवी डी जनानु नारी; ओकडे मुळवां मुळवां  
आवडी नवे अने पधी जरा आत्मगास येशे के तरत गोतानु शुं कर्तव्य  
छे ते गोतानी भेजेज समल शकाये. पशु आपि स्थिति प्राप्त थाय लां  
सुधी आ औरेंद्रभूमितु उल्लुट सावन विसारी न मुक्तानी ओरेंद्रुनु नहि  
पशु नेम अने तेम पुष्ट कर्तानी नम विनांती छे.

मौकिक.

## “सामान्य हित शिक्षा”

(१) ज्यथा—(पतना) ते ते धर्म संबंधी के व्यवहार संबंधी,  
परेकोइ भाटे के आ लोक भाटे, परमार्थे के स्वार्थे ले जे व्यापार करवाहां  
आवे तेमां भरापर उपरोग राख्नें ते तेनो सामान्यार्थे छे. विशेषार्थे  
विचारी जेतां तो आत्मातो शुद्ध निर्देश भेदकार्ये खांत भूर्णक करवाहां आ  
यतो भन बचन अने क्रापा द्वारा व्यापार-विशेष ज्यथाप छे, आयीज भ-  
द्वा गाँवी पुरपोजे ज्यथागे धर्मनी भाता कडी ऐवाही छे. अर्थात् आ-  
त्म धर्म (शुद्धेष्ठा) ते उत्तन करनारी, पावनारी तेमन उद्दि करनारी यावत्  
ओहांत सुखकारी आ ज्यथाहाल छे. ज्यथा रहित, यावनार उगो, रहेनार,  
ऐसनार, शयन करनार, जोनन करनार के बाप्यथु करनार ते ते यसनाइ.  
हियाओ भरतां त्रस के रथानर ऊदोनी छिंसा करे छे नेथी पाप कर्म वां-  
धे छे, तेनो विपाक कुटुक थाय छे; भाटे सुग विवेश, सज्जतोजे ते ते  
यसनाइक हियाओ करतां नेम नेम विशेषे ज्यथा सम्बाय तेम वर्तुं<sup>७</sup>  
हितकारक छे उमडे सर्व ऊवेने आत्म (पिता) सभान लेखतो। छतां आ-<sup>८</sup>  
पशु अने हुःअ नहिं करवानी भुद्धिथी सर्व पापस्थानो परीहरी आत्म  
नियम उरे छे तेज भाषात्मा पाप कर्म नयी लांवतो अन्यथा योतार  
उत्पत्ति क्षणीक सुखनी आतर नाहक अनेक निरपराधी ऊदोना प्राण्युने लेटे यि  
अन्यथाओ वर्ततो छतो ते हुम भारे कर्म लांव उरे छे. ने कर्म है दूर  
आरतां बहुन उडुक रस आयो छे. दृष्टां तरीके परम्परा रक्षणार्थे मुं

## सामाजिक द्वितीय शिक्षा।

43

મહારાજનો ખર્મદીવજ (રન્નોફરણ) તથા સામાપક પોપથાદિવત ખારણ શરૂઆત વર્ગથી રાખવામાં આવતો ચરણને પ્રમુખ તેગજ મુલ્લાલ (ગોઠાં) ગુરુદ્દિય લેટોણી પ્રમાર્બનાંથી રાખવામાં આપતી વાસંદી (સાપરણી) પ્રમુખ ને પરછુંને ખાધા ન કરે જોણા શલક્ષણ (સુંદાલા) હોય તેમજ તેવા છતાં પણ તેવોન (પોતે લાયે પ્રમાર્બના ઇપ) તેનો સદૃપગેગ જો કરવામાં આવે તેઓ તે સાર્વક હોઈ જયણ પાળવામાં સહાયભૂત થાય છે; અન્યથાં નહિં; દાંત તરીકે આનજકાલ આગ્નન દશાથી મુખ્ય જીવો ખૂબિ શુદ્ધ કરવા માટે તેવાં સારા ઉપકરણ નહિં રાખતાં પ્રાય: ખજૂરી નિગરેની વાસંદીઓનો ઉપગેગ કરતા દેખાય છે ને કે બાળક એકદિયી માંડી નસ જોગાના સંકાર માટે ભારે શાખ (સ્ટોટર) જેનું થઈ પડે છે. આપણુંને એક કંગો વાગતો હુખ થાય છે તો બાપડા તે કુદુર જાંતુઓના જનતો પાત થાય તેનો શાખ જેવા ધાતકારી પદ્ધતીં વાપરવાને હિંદુ ભાત્ર યા વિશેને કરીને જૈન માર્ગને છાન્દેજ નહિં. અદ્ય ખર્મ અને અદ્ય પ્રયાસે આ સેવાતો ભારે દોષ-દૂર થઈ શકે તેમ છતાં ઐતરધારીઓ તેની ઉપેક્ષા કર્યો કરી દ્વારા જીવોને ધર્યે નહીં, માટે આશા છે કે તે સંબંધમાં ખર્મની કંપણું માગણી ધરાવનારા તેનો તરત વિચાર કરી અમલ કરી સેશે.

ਧੀਅ ਪਥੁ ਭਿਪਰ ਅਤਾਵੇਲੀ ਚਖਨਾਇਕ ਕਿਆ ਤੇਰਵਾਨੀ ਜੜ੍ਹੇ ਪਤੇ ਛੇ ਤੇ  
ਮਾਂ ਪਾਣੂਜ ਉਪਯੋਗ ਰਾਖੀ ਜ਼ਰੋਨੀ ਵਿਰਾਖਨਾ ਨਹੀਂ ਫਰਤਾਂ ਜਾਇਆ ਪਾਇਸੀ।  
ਚਾਡਤਾ ਛਾਂ ਢੁੱਬਰਾ ਪ੍ਰਮਾਣੁ ਭੂਮਿਪਰਾ ਦਿਖਿ ਰਾਖੀ ਏਕਾਅ ਬਿਤੇ ਵਰਤਾਂ, ਤੇ-  
ਮਜ਼ ਗੇਸਤਾਂ, ਭਈਤਾਂ-ਭਵਾ ਰਹੇਤਾਂ, ਸਥਨ ਫਰਤਾਂ ਛਾਂ ਪਥੁ ਤੇਰੀਜ ਰੀਤੇ ਪ-  
ਰੋਧਪਾਤ ਨ ਥਾਪ ਤੇਮ ਸਾਰਚੇਤੀ ਰਾਖੀ ਰਹੇਉਂ। ਬੋਲਨ ਸੰਖੇ ਤੇ ਵੈਨਸਾਲ  
ਪ੍ਰਸਿਦ਼ ਆਹੀਂ ਅਮਕਾਥ ਆਂਤੇ ਯਾਹੀਂ ਅਨੁਨਾਕਾਥ ਵਰਣ ਤੇਮਜ਼ ਧੀਲਾ ਗੋਕਾਥ  
ਪਥਾਧੋ ਪਥੁ ਜ਼ਵਾਫੂਲ ਨ ਹੋਇ ਤੇਮਜ਼ ਜਾਥੁਤਾਂ ਕੇ ਅਮਾਖੁਤਾਂ ਜ਼ਰੋਮੇਂ ਸਾਂਡਾਰ  
ਛੀਨੇ ਨੀਪਸਨਾਵਾ ਨ ਹੋਇ ਤੇਮਜ਼ ਉਪਯੋਗਮਾਂ ਲੇਗ ਲੇਇਅ, ਤੇ ਪਥੁ ਵਿਵਸ  
ਛਾਂਜ ਪ੍ਰਕਾਸ਼ਵਾਣਾ ਰਥਾਨੇ ਪੱਡਿਆ ਆਜਨਮਾਂ ਰਾਖੀਨੇ ਵਾਰਦਾ ਜੇਖਿਓ, ਜੇਥੀ  
ਰਖਪਰ ਬਾਧਾਨੇ ਵਿਰਖੇ ਜਾਇਆ ਮਾਤਾਨੀ ਉਪਾਸਨਾ ਕੀਂਹੇ ਕਿਵਾਹ।

ભાગણું પણ હિત, મિત, ધર્મને આપ્યકરન આપે તેવું, અવસર ઉંઘિત વિચારીને, વહીની વળત મુજે વિરતિનુંતો મુખ્યપત્તિ તથા મોકાળા ઝુદ્ધયને પણ ઈંડ ગડારાળની પેરે રહ્યે કથા પ્રસંગે અવસર વસ્ત્રાંગળ (ક.

सरसंगतो छोटो) मुग्ध आगला राखीलोक दहा जयगु देवी गच्छाम्।

॥ प्राणे बहुत करणीलो करपि ताते नेम नेम अप्रगताले वर्णन तेम  
नेम उत्तमे आराधनालु आं तेवा निकु नां नियमालु चयनालु  
भूमा गातानी परे गातास नेम भरन गुण भी नीडेर गणार गुणाव प्रविष्ट  
पवित्र अंगवाणी जयगु गातानो आनाहर करी वर्तनास इगुतेना नेम  
आलोक अने परवेक्षणां दांती अने हुणनां पात्र थाय छे, आरे सुपुत्रनी  
पेरे पवित्र जयगु गातातुं आराधन करवा चूक्तुं नहि,

२ ऐड्याड—ऐडुं अनन के पाणी आना पवाठी के छांडाथो  
आगुणा सुख भाँधाए तेमज घेतो कुट्ठो घेवी आपराध-अनर्थ शेवे छ  
ते विचारो। पूर्व तथा उत्तर देशाने वर्ष आपराध आ वरहता थाई  
छेवे आ संश्वेधी ओट्को गेवे अपर्य शेवे छे तेवो नमुनो युओ। सर्वे  
आर्ह दुर्गुणी या तालिबाल्लेमो गोटे पाणी गोरा गोटे स्थानव करी रणेवा  
आननांगी पाणी धारव जोक युड (यसायुड) वास्तु नहिं राखतो जे  
वास्तुयो गेवे गाणी गोरे जे तेव गोरा पाणी रादित वास्तुयो दूरीते  
तेव भाजनमांथी पाणी तीकागी गोते या धीन भीरे छे, तेवी शास्त्र गन,  
घेवा मुनज्ज त जग्ना बाननां आराध्यात वाणीया संभूठिण अन चेता  
थाय छे, अधीन ते जग्नु आगुं बानन सुद आगय थप नय छे,  
नेचेतुं आ आज, पसु नेवा निर्दिशी छेवे गान करे छे अम छेतुं  
अपेक्षा नयी, ऐडुं अनन के पाणी अंतः मुदूर्त डिरांत अविनेक्षी के  
प्रगाढ़ी चाणी सुक्तनार छेवे अन प्रगाढ़ी अद्याध्य अवेनी विरापना कर  
नार थाय छे, आन समझे हैउ सान आजी परवायदी उरी नेम ते  
असुध्य छेवेनो नाडक संहार न थाय तेव चेतता रहेतुं धरे छे,

तेमज वारी, ऐगो, दिव्व सावे अवेवा गोरस आदिक आभक्ष्य भा-  
क्ष्य सवेवा वर्णतुं, नानामीटा जयगुगारो वर्णते पाक इक्षा जयगु रक्षित  
इवार्थी धर्षु छेवेनो थाय तीकागी वर छे, तेमज ऐडुं छांडाथी धर्षु  
धेवेन देया आवे छे, जे जयगुर्वेक होक राने वर्तनास आवे तो  
क्रांते धर्षु वापक नहि आनां धर्षु आराधनामो धर्षु देयो वान सदने  
हांसव ईरी शास्त्र, आरे दे रुहो। धर्म अने वापरीव थप जयगुमो  
ऐक पण धर्षु विसारणे नहि.

## सामन्य लित विद्युतः

४५

**३ उडाड अद्वी—गानापता भरवु पट्ठी या हुत्रु खुकी . विग्रेइना बर्जा वर्षते भगु डेक्काणे नारुक अर्वा करवागो आवे छे अरे उत्त वर्षते आल फर्गा गोप्य करवानी जैररकारी करवागो आवे छे . द्वित वर्षी गानापता भावापता वर्षागो गोप्यगवांडे गोप्य वारी तत गत गत गोप्य वर्षी वेम वेमने घर्मि स्थापि धाय वारार वेमानी तथा गोतानी सहगति नेहि रीते धाय वेमन वर्षेतु उपित छे . अवरा करवा येत्रुत ते आध्यततुं भोग भुली जर्द पट्ठी करवा दोक लाललाली नारुक गोप्य अर्यमा उत्तरुं ते कर्त्ता तेयवाज घनगो ध्यय भरमार्य मार्ग करवी ऐक छे . पुत्रादिकना जन्म तथा द्वन्द्वादि प्रसंगे भरवा भावगिक था डेव शुक्री पूल विक्ति भुली घोटी धाम धूम रथवा -वारेंगा भवडे करेडे ज्वेनो विनाश धाय तेवा धृष्टानुं छेऊ विग्रेइना अभित द्रव्योग गेर उपरोक्त करवामो आवे छे , तेव वारशीइ-सजन्ननोने करतुं धरतुं नहीं .**

**४ अण्डापितु अवतुं शीक्षण्ड अरो अवतुं वर्तन-आणापे गोताना भावापो तरखी आरो ( धार्मिक अने व्यावहारिक ) . वारसो मिळारा ठगेनरथी रहेवा द्वेवारी अथवा लाग्यदेवो मिळन्या छनां तेवो छुसांगवारे विनाश करवायी प्रायः गोताना वाणिज्ञाने तेवो उमदा वारसो आ-पया भावयसागो शी रीते बारी चडे ? प्रायः कहेअथी कहाय सत्संग येगे तेवा गाणापे पछु गोतानां वाण वस्त्राने तेवो उमदा वारसो आपय भावयसागो अने पछु अरो यतः-सत्संगतिः कक्षयकि न करोति पुसाम् अर्थात् ‘ वारग रागति , क्लेष लक्ष्मी पुरुषेने शुं शुं सत्वण नवी लंक-गारी आपाती ? ’ उत्तम सर्वगतिभेदे प्राणी उत्तमताने पामे छे , उत्तम अने छो तो धुख देवी अगृह्या अन्तर्गति करवा अने इनी उत्तमदृष्टि पामवा क्लग्नरथी रहे वारी ? शासना नायु कहे छे के भेदामो जोटी-भेदामो घोटां धूमे आपाती दुसर्गति छे , तो आहो दृष्टी चाणवाने धृष्टनारो तेवु माटवति जेवी दुसर्गति साकारसो ? आटबुं प्रसुने कही छे विद्यारिये के गोतानी आण वस्त्राने शुगी करवा धृष्टता आपातीचे देवने तेवी कू-दुसर्गतिथी अपातरा अने सत्संगतिगां लेऊ उटवी वधी धृष्ट राम-वानी जरर छे । नडिसो वे आपातेनेत्ते वाणिज्ञानो डितक्ती भावना कु आहितउत्ती ? गेवउक्ते कही शक्षुङ्कु ए अकिलहती , शक्तु-दृश्मन के-**

४३

## શ્રી જૈનધર્મ મ્રકાશ.

બાળ માનવા જોઈએ કુમકે તેજોએ ગેતાનાં ખાળ વચ્ચોંને જાણી જોઈતે કુ જોન્નરકારીથી સહગતિનો ગાંગ બષે કરી દુર્ગતિનો રસ્તો લયાડો કરી આપો. અને રસ્તે દોર્સા ગાડે. બાળક જન્મા પડેલાં પણ જાણીએ તેને વ્યાચા ન થાય તેમ વિધા સેવન સંબંધમાં સંતોષાથી ગાયાપે વંતું જોઈએ જન્મ થયા બાદ તેની બાલ્યચય સુધીમાં તે અપશાદ ન સાંભળે કે ન હોલે, એક સરદા જંતુને પણ મારવા ન શીખે કે નમારે તેરો ઉપરોગ રાખવો જોઈએ તથા તેને કોઈ પણ મારી સંગતિ ન થવા પણ તેની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. સમજાણો થયો કે તરત તેને સારા વિવાયુર કે ધર્મ ગુરુને દૂધાને કરી દોયો જોઈએ; એ વિવાયુર કે ધર્મ ગુરુ તેને વિનામાદિ ઉત્તમયુદ્ધેશ્યાંતું સારી રીતે શીક્ષણ આપે, નેથી પ્રાપ્ત થગેલી વિવાની સફળતા ઇથી વિનેક રલ તે પણે અન્યથા કુસંગ-કુચછંદ ગોગે વિવાય વિવાહીન રહેશાયી વિનેક રહિત પણ જેની આચરણ કરતો રણ્ણા રેઝની જેમ જનરટીને વિને તે પરિબ્રાણ કરે છે.

બાળ લગ્ન, કલેડાં-આ સર્વ વિવા વિનામાદિક ગામવાગાં ગોયા વિધનૃપ નીરડે છે; એને પરિણામે તેઓ આ સોકના સ્વાર્થથી થાટ થઈ પરમનું પણ સાધન પ્રાપ્ત: કરી શકતા નથી; ગોટલુંજ નદી પણ અનેક પ્રકારના દુર્ઘટા શીખી-આચરી મહા કષ્ટના બાળી થાય છે. મારે બાળ વચ્ચોંનો સુધારો કરવાની જોખમદારી માણાપોના શીરપર જોઈ નથી, તે તેજોએ ખુલ્લ વિચારવાંની જરૂર છે. માણાપોની કસુરથી દોડરા ભર્યે પ્રાપ્ત: રહેવાથો તેજોનેજ એક ચાગડ્ય થાય છે તેમજ તેઓની પરિવ કણાંલુંથી બાળકો વ્યવહાર અને ધર્મકાર્યમાં નિપુણ થવાને લાગે ઉભ્ય સોકમાં સુધી થવાથી તેઓને અયોભવમાં આશીર્વાદ આપેલે પરંપરાને અનેક છ. વોના હિતકર્તા થાય છે. તેમજ તેઓ એઠ માણાપ તરીકની પોતાની ઇરાજોને પોતાના બાળધ્યચાં કે સંબંધીએ પ્રતિ અદ્વ કરવા ચુકતા નથી; હમેશાં સાજનત વર્જિમાં પોતાના સહ વિચારો દેવાવવા યત્ન કરે છે. તેમજ પારમાંધ્યક કાયોમાં આગળ પડતો ભાગ લે છે અને બીજાન ગોળ્ય છુંને પણ જોતપેતાને તૂંયોઽય કરવા પ્રેરે છે. આ થધા શયદ માણાપોના ઉત્તમ શીધ્ય અને ઉત્તમ વર્તનપર આધ્યાત્ર રાખતા હેતાથી આપગે ધર્મયું કે. હું પછી પોતાની સંતતિનું ભનું ધર્મનારા માણાપો ગેતે ઉત્તમ રહ્યો.

चर्चापत्र.

४७

કશ્ય પારી ઉત્તર વર્તન આદી પોતાના બાળઅચ્છાંગેના અંતઃકરણના  
આંશિકાંદ મદુળ કરના બાળગમળી થશે.  
તથારતુ.

મુનિ કર્પૂરવિજય.

## ચરચા પત્ર.

શ્રી જૈનધર્મ પ્રકાશના અધિપતિ સાહેબ.

શ્રુ. લાવનગર.

નીચેની ખીના આપના ચોપાન્યામાં પ્રગટ કરશે.

બનારસ શ્રીમહ યશોવિજયજી નૈત સંસ્કૃત પાઠશાળા ખાતે  
શ્રી માંગરોળાણા રોડ આમદારના તલકચેડ (૩.૫૦૦) પાંચસો બેટ  
આપણા છે, વાણી આ અદસ્થ પોતાના ખર્ચથી સ્કોલરશીપ તથા પોરાકી ખર્ચ  
નિગેર ખર્ચ આપી પાંચ નિવાધણીને શ્રી બનારસ પાઠશાળામાં અભ્યાસ  
કરના મોકલાનાનો ઉત્ત્સાહ જણ્યાં છે, તો યોઝ વખતમાં તેઓ સાહેબ પાંચ  
નિવાધણીને મોકલાનો ઉત્તર કામોદીના પોતાની લક્ષ્ણી વાપરવાને આ અહુરસ્થ  
સારી રીતે સમજે છે, તેથી આ અત્યુત્તમ કામ જાણી પોતાની શક્તિ માં  
૫૮ મદ્દ કરી તેમણે પોતાની ઉદ્ઘરતા જણ્યાં આપી છે. આ પ્રમાણે દરેક  
જેન અદસ્થને યથાશક્તિ મેદદ આપવાની આવસ્યકતા છે.

આ પાઠશાળા ખાતે એક મોટુ ઇંડ એકફું કરી તે ઇંડમાંથી બના-  
રસ પાઠશાળામાં અભ્યાસ કરીને તૈયાર થયેલા નિદ્રાનેને પગાર આપણે  
યોગ્યતા મુજબ તેમાંના કેટલાગેકને ઉપદેશકો તરીકે ગામો ગામ જૈનધર્મનાં  
તરતોના નાડેર ભાગ્યો આપવાના કામમાં જોઈવા, આપણા મુનિ મહારાજ  
જને અન્ય દર્શની અભિન્નો પસે ભણ્યું પડે છે તેને બદ્ધે આ અન્યક  
નિદ્રાનેના કેટલાકનો તે કામમાં જોડાયા, કેટલાકો નૈનશાળા પાઠશાળા,  
એમાં ગામો ગામ ઘોરણુસર નૈત નિયમોને અભ્યાસ કરાવવાને જોઈવા,  
કેટલાગેકને અંજુ પુરુષો, અર્ણુ તીર્થ બને અર્ણુ મહિરોનો ઉદ્ધાર કરાવ-

४६

## શ્રી કૈનાથની પ્રકાશ.

વાના કાનમાં ગોડવાના, કેટલાંગોકેને દેખદિયું ગાનદાયચો દુઃખતા આપયા નૈતાંદુંઘેને ઉપદેશ આપી તેમાંથી બચાવવાના કાગળાં ગોડવાના વિગેર દરેક ધ્યાનિક કાર્યાં ગોડવાથી આ પ્રદેશાભાગાં તૈયાર થયેલા રિષ્ટાનો છુંદળી પરિત તેજ કારો કરો. આથી કેટલાક આનાર્થી બાન્ય ગાડલ્યો પોતાના બચ્યેથી પણ ધ્યાનિક કાર્ય બનનારાને તૈયાર થાય.

વળો દરેક કૈનથાળાની દેખરેખ પણ આ દુંગાથી રાખાના આવે અથે જે ને કૈનથાળાનો મદદ આપવાના બરર હેઠ લાં લાં ગઢ આપવામાં આવે-ઇમકે કેટલીક કૈનથાળાનો ઉપરીના દેખ રેખ મિના થોડો યોડા વખત ચાલીને બંધ પડી બાય છે. વળો દરેક કૈનથાળાનેથી પરી ક્ષા લેતી અને ન હેઠ લાં નાની સ્થયરૂપ કરાતાની વિગેર કાગ સાર જોક કૈન એન્જિનિયરના ઇન્સ્પેક્ટર (પરીદૂક) પણ આ પાડશાળાના રંગાંથીજ શરૂઆતાં આને અને કૈનથાળિક ડેવલફી આતાના ઉપરી અભિક્રીત રીકે બનારસ પાડશાળાના અંદ્યક્ષ રહે. આ પ્રગાણે કાગ પણ ત્યારેન ઘરેખર જેણ ધર્મનોં ઉદ્ઘ થાય, ગુનનો ફેલાયે થાય અને શારાનની ઉમતિ પણ ત્યારેન થાય. આ કામ ને કે તરત બનતું સુશ્કેલ છે, તો પણ શાક, વ્યાઙ્ઘાદુર વસનાનુભાગ ગ્રોકમળ તથા એતસીલાઘ ભીયક્ષણીએ જેણ પાતીતાથી વીરભાગ પાડશાળાના પચાસ પચાસ હળવ ઝડીણાની મેડી બદ્ધીસોણ આપી છે, કેંજ પ્રમાણે તે ગૃહસ્થી અને દરેક કૈનથાંદુંઘે આ આતાના પોતાના ઉત્સાહ પૂર્વિક ઉદ્ધર ધોરણીથી યથારાક્ષિત જેટલી બની શકે તેટલી તન મન અને ધનથી ગઈ કરશે તો હું ધારું છું કે આઉદ્ધા લાખ ઉપરાંતતું મેડું ઇડ એકડું ધધ જરો આને ઉપર લખેલા સર્વ મનોરથો પણ પાર મને; માટે દરેક કૈનથાંદુંઘે આ અતિ ઉત્તમ દર્શાનાણી તેમાં તન મન અને ધનથી સારી ગફા કરશો, એતી મારી નામ પિનંતી છે.

૩૦. વેચ્ચીચંદ સુર્ચંદ શ્રી મેસાલુલાલા

હાદ સર્ટિફિકાટ

અણામગંજ.

आ पाठशालाकु मदद करनी सर्व जैनी भाईयोंकु उचित है।  
अबी बाबीस वीद्यार्थीओ और सात साधु पढ़ते हैं। छ सात  
वीद्यार्थी आनेवाले हैं। दस कलाक पढ़नेमे जाते हैं।

भनारस केन्द्र पाठशाला शास्त्री।

### कृपामनी पठायः

- १-४ श्री गोलीयं६ डीसयं६  
२-५ भाई शालीहास देवकरण  
३-६ देवाये अमा जीस्या  
४-७ शा नगीनदास वमण्यं६  
५-८ शा उगनलल नगुलाध  
६-९ शा सोंदण्यं६ हीरायं६  
७-१० भाई निर्यं६ तारायं६  
८-११ शा शापवाल भुशालयं६  
९-१२ शा भाप्लाल ग्रेमयं६  
१०-१३ शा रतनयं६ शुद्धय  
११-१४ शा कृष्णभाध धरमयं६  
१२-१५ शा रतनरी अवय  
१३-१६ भृथयांगी नेमीहास शालीहास  
१४ चेकुरी ओवड शालीहास  
१५-१८ शा आप्तकु शालीहास  
१६-१९ शा अगनवाल शशावल  
१७-२० शा वनकु नयु  
१८-२१ शा जमनादास हरयं६

- १-४ शा क्लेहाभाध दामल  
१-५ शाखवी ठुकरयं६ इमगसी  
१-६ शा संधराज रमल  
१-७ शा ठुकरयं६ तारायं६  
१-८ शा नगीनदास गोतीयं६  
१-९ शा नंदाल लगाल  
१-१० शा खुलाल ओपाल  
१-११ भवेरी ओटालाल ललुभाध  
१-१२ शा भनसुखलाल जगत्तपन  
१-१३ शा आलाभाध शुद्धाभयं६  
१-१४ गेहेताल भानयं६ डेसवल  
१-१५ शा नागरेहास घेतसी  
१-१६ शा उमेदयं६ गुलाभयं६  
१-१७ शा आलाराम वीर्यं६  
१-१८ शा सुंदरल शीरायं६  
१-१९ शा लालयं६ क्लानाल  
१-२० राजमंगलदास गोरखनदासजेकर  
२-२१ शा नगीनदास छगनलाल

अमारी तरहथी छायेव वेयायु युक्त (२४६) ना लीटट उपरांत

### नवी युक्तानी ज्ञेन भप्त

श्री तत्त्वनिर्मीय प्राप्ताद—भुनिराज श्री आत्मारामलु कृत भृ-  
न्तावना, उपैह्यात, जन्मयरिनि विजेन्ता वधारा सर्वित आ-  
युक्त अत्यंत उपयोगी है। की० इ० ४-०-०  
श्री उपदेश प्राप्ताद स्थान प थी० (भाग २ ले) अमार० क्लेलु  
आपांतर, या अंथ शापकुलाधयोने अपरथ वांच्यवा लायक है।  
पांच स्तंभमां सुमारे ७५ उपरांततो क्लेला० की० ३२-०-०

३	हुनियामां शैथी प्राचिन धर्म, लभनार साक्षयाद् भाषेन्द्रयाद् वरीमाणी, अनेक थायामांथी चारसार शब्दाणि कर्त्तव्याद् करेते हैं। जमानाने अनुसरीने खास उपयोगी हैं। युक्त रूप औती करी हैं।	की. ३. ६-८-०
४	अदार दोष निवारण-लभनार आतुपचाद मलुकर्याद् भद्रयनामा झुक्ता ग्रेमालामां डिभत भादुज एप्लो राजी हैं। युक्त भादुज उपयोगी अने लालकारूक हैं। इनके जैगामांधुमेने अग्रीत करवा लालामधु इरीये छाँची।	की. ३. ०-९-६
५	शामायक अने देशावगमसिंह ग्रन—लभनार शा, खालालाह कुल, युक्त उपयोगी हैं।	०-४-०
६	शमिदीवाना, (ज्ञानार्थिमांथी)	०-१०-०
७	शामक धर्मी चारिता, (धर्मिनांदुमांथी)	०-१२-०
८	शमेलार चरित लालांदर, (चरितामा धर्मीनो गुरुमान शमेल उपयोगी अने रसीक अन्याहा तक्षशी ग्रन यादुनि लक्ष्मी अप्पेल हैं।)	०-४-०
९	शमेल डिलि शारदा, (गर्वी अर्दिली)	०-८-०
१०	शमेला गोल (शार शारामान) रसीक शमेल	०-८-०
११	शमेलवासि कैमालकर्मा,	०-१२-०
१२	शी लत्यार्दि लालव लालू रु (लालामान लेलामानो लेलामानो लक्ष्मी उपयोग हैं।)	०-१-०
१३	शी ग्री. श. यु. चरित्र पर्व १० अ०, (लालू रु लो) श्री चाहुरीर श्यामीलुं विस्तारवालुं चरित्र, असंज्ञापत्र अन्यों ३. लालू युरेपाना चरित्रो समावेदा है।	१-१२-०
१४	शी वर्द्धमान लेला लालांदर शारी।	२-८-०
१५	शी विविव युल शंडह लालू २ लो शारी।	१-०-०
१६	श्री प्रकरण रत्नाकर लालू २ लालो विलाल २ लो २-०-०	(१७)
१७	" "	विलाल ३ लो २-४-०
१८	" "	विलाल ४ लो २-०-०
१९	श्यामालालजी अर्थी शारीत,	२-०-०
२०	शामाली व्याकरणानी डुडीला, लार्थी चारीत युरीके,	३-१-०
२१	श्याम रत्नी शूल,	०-८-०
२२	शी उपर्खित लालू अपर्यालू शूली श्याक ५-३ इरेक्ता ०-५-०	उपर लभेल युक्ता तथा रेशमी नवकार्यापाठी श्यामाले अने हुत्यारी-विमालापाठी होइ अग्ने अमाली रेशमीरामा अपालू, लालू।